

જનસંપર્ક અધીકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩
કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૦૮/૦૩/૨૦૧૮ શુક્રવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૪૭૨/૧૮

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૩૬ કેસ કરી, ૩૧ વ્યક્તિઓને ઝડપી, ૧૫૪ લીટર દેશી દારૂ, ૧૫૧ બોટલ ઈંગ્લીશ દારૂ, ૨૪ બિયર ટીન, ૧ સ્ફૂટર, ૧ કાર અને ૧ રિક્ષા કબજે કરી હતી. તેમજ જુગાર ધારા હેઠળ ૧ કેસ કરી ૩ વ્યક્તિઓને અટક કરી રોકડ રૂપિયા ૧૫,૮૦૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૪૭૩/૧૮

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૫૪ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી ૯૩ મુજબ ૫ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

છેતરપીડીની ફરીયાદ:-

સમાચાર યાદી નં.૪૭૪/૧૮

ઘાટલોડીયા: કાંતીભાઈ શંકરદાસ પટેલ (ઉ.વ.૬૦) (રહે. શંકરદા સોસાયટી કે.કે.નગર રોડ ઘાટલોડીયા) એ તા.૦૮/૦૩/૧૮ નારોજ ઘાટલોડીયા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૩/૦૬/૨૦૧૭ થી તા.૧૫/૦૬/૨૦૧૭ સુધીના સમયગાળા દરમિયાન આરોપી (૧) મો.નં.૯૧૦૨૪૫૯૨૮૭ (૨) મો.નં.૯૫૭૨૨૭૭૭૧૯ ના ધારકે કાંતીભાઈ પટેલના મોબાઈલ ઉપર વાત કરી કાંતીભાઈના ડેબીટ કાર્ડની વેલીડિટી પુરી થઈ ગયેલ છે તેમ જાણાવી કાંતીભાઈને વિશ્વાસમાં લઈ તેમની પાસેથી ડેબીટ કાર્ડ નંબર તથા ઓટીપી નંબર મેળવી લઈ કાંતીભાઈના એસ.બી.આઈ બેંકના ખાતા માંથી કુલ રૂપિયા ૧,૩૧,૪૬૮/- ઉપાડી લઈ છેતરપીડી અને વિશ્વાસઘાત કર્યો છે. આ ગુનાની તપાસ પો.ઈ.શ્રી જી.એસ.પટેલ ચલાવે છે.

સોનાની ચેઈન ખેચી તોડી લઈ ગયા:-

સમાચાર યાદી નં.૪૭૫/૧૮

શાહીબાગ: બેલાબહેન બીપીનકુમાર મુક્તા (ઉ.વ.૪૪) (રહે. રજનીગંધા ટાવર સુજાતા ફ્લેબી બાજુમા શાહીબાગ) તા.૨૬/૦૨/૧૮ રાતના ૮/૪૫ વાગ્યાના સુમારે ચંદ્રમણી હેસ્પિટલ પાસે આવેલ પોસ્ટ ઓફિસ આગળથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક મોટર સાયકલ ઉપર આવેલ બે પુરૂષો બેલાબહેનના ગળામાંથી સોનાનો દોરો કિંમત રૂપિયા ૩૬,૦૦૦/- ખેચી તોડી લઈ નાસી ગયા હતા. આ અંગેની ફરીયાદ બેલાબહેન મુક્તાએ તા.૮/૩/૧૮ નારોજ શાહીબાગ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.ઈ.શ્રી આર.પી.ડાભી ચલાવે છે.

ઓઢવ: વર્ષાબહેન વા/ઓ જીજ્ઞેશભાઇ શાહ (ઉ.વ.૩૨) (રહે. ઇન્દિરાપાર્ક સોસાયટી આદિનાથનગર ઓઢવ) તા.૦૭/૦૩/૧૮ રાતના ૧૦/૩૦ વાગ્યાના સુમારે ઓઢવ સોનીની ચાલી બ્રીજ ઉતરતા રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક મોટર સાયકલ ઉપર આવેલ બે પુરૂષો વર્ષાબહેનના ગળામાંથી સોનાની ચેઈન પેડલ સાથે કિમત રૂપિયા ૩૮,૦૦૦/- ખેચી તોડી લઈ નાસી ગયા હતા. આ અંગેની ફરીયાદ વર્ષાબહેન શાહે ઓઢવ પોલીસ સ્ટેશન ખાતે નોધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એ.ડી.ભદ્ર ચલાવે છે.

બળજબરીથી કઢાવી લેવા બાબત:-

સમાચાર યાદી નં.૪૭૬/૧૮

સોલા હાઈકોર્ટ: આકાશગર્ગ ઉમેશગર્ગ જાટવ (ઉ.વ.૨૩) (રહે, ગાયત્રી નગર, સરસવતી નગરની સામે, ન્યુ રાણીપ) એ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોધાવી છે કે તા.૦૮/૦૩/૧૮ કલાક ૧/૩૦ વાગ્યાના સુમારે ચાંદલોડીયા દુર્ગા સ્કુલ પાસે ડાઇવર્ઝન રોડ નજીક એક્ટીવા તથા મોટર સાયકલ ઉપર આવેલ ચાર પુરૂષોએ ભેગા મળી આકાશગર્ગ તથા સાહેબને રોકી માર મારી મોબાઈલ ફોન અને રોકડ રૂપિયા મળી કુલ રૂપિયા ૨૮,૫૦૦/- મતાની બળજબરીથી કઢાવી લઈ નાસી ગયા હતા. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એસ.જે.વસાવા ચલાવે છે.

ભુલથી ઝેરી દવા પી જતા મૃત્યુ:

સમાચાર યાદી નં.૪૭૭/૧૮

કાગડાપીઠ: રીનાબહેન વા/ઓ હરેશભાઇ ઓંધરવા (ઉ.વ.૨૯) (રહે. ફકીર મુખીની ચાલી બહેરામપુર) ને ઉધરસની બિમારી હોઈ તા.૭/૩/૧૮ કલાક ૯/૦૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે ઉધરસ આવતા ઉધરસની દવા સમજી ભુલથી અનાજમાં નાખવાની દવા પી જતા સારવાર માટે એલ.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યા સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નિપજયું હતુઆ અંગે કાગડાપીઠ પોલીસે અકસ્માત મોત નોધી આ અંગેની તપાસ પો.સ.ઇ.શ્રી વી.એલ.વાઘેલા ચલાવે છે.

આત્મહત્યા:-

સમાચાર યાદી નં.૪૭૮/૧૮

રિવરફ્રંટ વેસ્ટ: નિતીનકુમાર દિનેશભાઇ રાહોડ (ઉ.વ.૧૯) (રહે.મુસાસુલેમાનની ચાલી ટોપી મીલ પાછળ રાજપુર ગોમતીપુરુ એ અગમ્ય કારણસર તા.૦૮/૦૩/૧૮ સવારના ૧૧/૧૫ વાગ્યા પહેલા ભીખાભાઇ ગાર્ડન સામેના વોક-વે ઘાટ નંબર-૦૮ નજીક નદીમાં પડી ડુબી જઈ આત્મહત્યા કરી હતી. આ અંગે રિવરફ્રંટ વેસ્ટ પોલીસે અકસ્માત મોત નોધી આ અંગેની તપાસ હે.કો.શ્રી હસમુખભાઇ મગનભાઇ ચલાવે છે.

ચાંદખેડા: દર્શન સ/ઓ નરેશકુમાર શાહ (ઉ.વ.૨૩) (રહે. શ્યામ બંઝલોઝ વિભાગ-૨ આઇ.ઓ.સી.રોડ ચાંદખેડા) એ અગમ્ય કારણસર તા.૦૭/૦૩/૧૮ રાતના ૮/૧૫ વાગ્યા પહેલા પોતાના ઘરે પંખાના હુકમાં દુપટ્ટો બાંધીગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે ચાંદખેડા પોલીસે અકસ્માત મોત નોધી આ અંગેની તપાસ હે.કો.શ્રી રસીદખાન કાલેખાન ચલાવે છે.

શહેરકોટડા: રામકિશોર કાલીચરન નિશાદ (ઉ.વ.૩૫) (રહે.સાગર દેસાઈની ચાલી ગુપ્તા ડેરી પાસે પ્રેમનગર મેમ્કો) એ અગમ્ય કારણસર તા.૦૮/૦૩/૧૮ રાતના ૦૦/૩૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે પોતાની જાતે પોતાના શરીર ઉપર કેરોસીન છાટી સળગી ગયા હતા. સારવાર માટે સીવીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમ્યાન બપોરના ૧૫/૧૫ વાગે તેમનું મૃત્યુ નિપજયું હતું આ અંગે શહેરકોટડા પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી હમીરભાઈ અળસીભાઈ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.